

**Ordinary Gazette Part- I-A / 2007**

<b>Issue No.</b>	<b>Date</b>	<b>Department</b>
<b>Issue No.1</b>	<b>04-01-2007</b>	<b>This Gazette may contain multiple departments/offices</b>
<b>Issue No.4</b>	<b>25-01-2007</b>	<b>This Gazette may contain multiple departments/offices</b>
<b>Issue No.8</b>	<b>22-02-2007</b>	<b>This Gazette may contain multiple departments/offices</b>
<b>Issue No.10</b>	<b>08-03-2007</b>	<b>This Gazette may contain multiple departments/offices</b>
<b>Issue No.13</b>	<b>29-03-2007</b>	<b>This Gazette may contain multiple departments/offices</b>
<b>Issue No.17</b>	<b>26-04-2007</b>	<b>This Gazette may contain multiple departments/offices</b>
<b>Issue No.22</b>	<b>31-05-2007</b>	<b>This Gazette may contain multiple departments/offices</b>
<b>Issue No.26</b>	<b>28-06-2007</b>	<b>This Gazette may contain multiple departments/offices</b>
<b>Issue No.30</b>	<b>26-07-2007</b>	<b>This Gazette may contain multiple departments/offices</b>
<b>Issue No.35</b>	<b>30-08-2007</b>	<b>This Gazette may contain multiple departments/offices</b>
<b>Issue No.36</b>	<b>06-09-2007</b>	<b>This Gazette may contain multiple departments/offices</b>
<b>Issue No.38</b>	<b>20-09-2007</b>	<b>This Gazette may contain multiple departments/offices</b>
<b>Issue No.39</b>	<b>27-09-2007</b>	<b>This Gazette may contain multiple departments/offices</b>
<b>Issue No.43</b>	<b>25-10-2007</b>	<b>This Gazette may contain multiple departments/offices</b>
<b>Issue No.48</b>	<b>29-11-2007</b>	<b>This Gazette may contain multiple departments/offices</b>



सत्यमेव जयते

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLVIII]

THURSDAY, JANUARY 4, 2007/PAUSA 14, 1928

[No. 1

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A

### CENTRAL SECTION

Orders and Notifications (other than those published in Part IV-B) under the Gujarat Local Boards, Village Panchayats, Municipal Boroughs, District Municipal, Primary Education and Local Fund Audit Acts.

શિક્ષણ વિભાગ

જાહેરનામું

સચિવાલય, ગાંધીનગર, ૨૧મી નવેમ્બર, ૨૦૦૬.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-૧૯૪૭.

ક્રમાંક : કેએસએચ/૨૧/કેએચપીએસએચ/૧૦૦૪/૧૪૨૧/૪. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો, ૧૯૪૮ વધુ સુધારતા કેટલાક નિયમોનો મુસદ્દો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૭ (સન ૧૯૪૭ના મુંબઈના ૬૧મા)ની કલમ-૬૩ની પેટા-કલમ (૩) થી કરાવ્યા પ્રમાણે, તારીખ : ૧૮મી સપ્ટેમ્બર, ૨૦૦૬ના શિક્ષણ વિભાગના સરકારી જાહેરનામા ક્રમાંક : કેએસએચ/૧૮/કેએચપીએસએચ/૧૦૦૪/૧૪૨૧/૪ હેઠળ, તારીખ : ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૦૬ના ગુજરાત સરકારી રાજપત્ર, ભાગ-૧/એ, સેન્ટ્રલ સેક્શનના પાના ૧૭ અને ૧૮ ઉપર પ્રસિધ્ધ કર્યો હતો અને તેનાથી અસર થવાનો સંભવ હોય તે તમામ વ્યક્તિઓ તરફથી રાજપત્રમાં પ્રસિધ્ધિની તારીખથી ત્રીસ દિવસની અંદર વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા.,

અને સદરહુ જાહેરનામાના મુસદ્દાના સંબંધમાં, સરકારને કોઈ વાંધા અથવા સૂચનો મળેલ નથી,

તેથી, હવે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૭ (સન-૧૯૪૭ના મુંબઈના ૬૧મા) ની કલમ-૬૩ થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો, ૧૯૪૮ વધુ સુધારવા નીચેના નિયમો કરે છે:-

૧. આ નિયમો મુંબઈ પ્રાથમિક શિક્ષણ (ગુજરાત ત્રીજા સુધારા) નિયમો, ૨૦૦૬ કહેવાશે.
૨. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો, ૧૯૪૮માં, અનુસૂચિ-છ માં વિદ્યમાન શરત ૫ ને બદલે, નીચેનો મજકૂર મૂકવો :-  
“૫. શાળા બંધ કરવા અથવા વર્ગોની કુલ સંખ્યા ઘટાડવા બાબત :- કોઈપણ માન્ય ખાનગી પ્રાથમિક શાળાનું સંચાલક મંડળ અધિકૃત અધિકારીની લેખિતમાં પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય પોતાની શાળાના વર્ગોની કુલ સંખ્યામાં ઘટાડો કરી શકશે નહિ અથવા શાળા બંધ કરી શકશે નહિ. આ હેતુ માટે, સંચાલક મંડળે પોતે જે તારીખથી વર્ગોની સંખ્યા ઘટાડવા અથવા શાળા બંધ કરવા ધારતું હોય તે તારીખથી ઓછામાં ઓછા છ મહિના પહેલાં અધિકૃત અધિકારીને અરજી કરવાની રહેશે. આવી અરજી મળ્યે, અધિકૃત અધિકારી, પોતે જરૂરી ગણે તે રીતે, પોતાને જરૂરી લાગે તેવી તપાસ કરી શકશે અને અરજીને પૂર્ણતઃ અથવા અંશતઃ મંજૂર કરવાનો અથવા નામંજૂર કરવાનો નિર્ણય કરશે.”

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

પોપટસિંહ વાઘેલા,

સરકારના ઉપસચિવ.



REGISTERED No. G/GNR/2

सत्यमेव जयते

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLVIII]

THURSDAY, JANUARY 25, 2007/MAGHA 5, 1928

[No. 4

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A

### CENTRAL SECTION

Orders and Notifications (Other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal,  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર

તા. ૧-૧૨-૨૦૦૬ થી તા. ૩૧-૧૨-૨૦૦૬ દરમિયાન પ્રસિધ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી

અનુક્રમ નંબર	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિધ્ધિની તારીખ	વિભાગનું નામ
૧	૨	૩	૪	૫
		ભાગ-૧-અ		
૧	૧૧૫	કશ/૨૬/નશમ/૧૫૦૬/૮૨૬/ચ	૨૮/૧૧/૦૬	શિક્ષણ વિભાગ
૨	૧૧૬	કેપી/૩૧/૨૦૦૬-પસમ-૧૦૨૦૦૦-૨૦૮૭-પાર્ટ ફાઈલ-૬	૩૦/૧૧/૦૬	પં.ગ્રા.ગૃ.નિ. અને ગ્રા.વિ. વિભાગ
૩	૧૧૭	ક્રમાંક : કશ/૨૫/નશમ/૧૫૦૬/૮૮૨/ચ	૬/૧૨/૦૬	શિક્ષણ વિભાગ

જે. એ. શાહ,  
શ્રેયાન વ્યવસ્થાપક,  
સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર.





सत्यमेव जयते

REGISTERED No. G/GNR/2

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLVIII]

THURSDAY, FEBRUARY 22, 2007/PHALGUNA 3, 1928

[No. 8

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A

### CENTRAL SECTION

Orders and Notifications (Other than those published in Part IV-B) —  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર

તા. ૧-૧-૨૦૦૭ થી તા. ૩૧-૧-૨૦૦૭ દરમિયાન પ્રસિધ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી

અનુક્રમ નંબર	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિધ્ધિની તારીખ	વિભાગનું નામ
ભાગ-૧-અ				
૧	૧	કેવી-૧ થી ૪૬ ઓફ ૨૦૦૭-એનપીએમ-૧૩૨૦૦૫- ૭૪૨૯ (૧) થી ૪૬) આર.	૪-૧-૦૭	શ.વિ. અને શ.ગૃહ.નિ. વિભાગ
૨	૨	કશ-૩૧-નશમ-૧૬૦૬-૫૯૮-ચ તા. ૨૯-૧૨-૦૬	૫-૧-૦૭	શિક્ષણ વિભાગ
૩	૩	કેવી-૪૭-૨૦૦૭-એએમએન-૨૦૨૦૦૦-૭૧૨૨-પી	૬-૧-૦૭	શ.વિ. અને શ.ગૃહ.નિ. વિભાગ
૪	૪	કેવી-૨૦૦૭નો ૪૮-જનમ-૮૦૨૦૦૬-૫૪૨૯-પી	૧૦-૧-૦૭	શ.વિ. અને શ.ગૃહ.નિ. વિભાગ
૫	૫	કેવી-૫૫-૨૦૦૭-એએમએન-૮૦૮૫-૨૪૫૦-પી	૨૫-૧-૦૭	શ.વિ. અને શ.ગૃહ.નિ. વિભાગ

જે. એ. શાહ,  
શ્રેયાન વ્યવસ્થાપક,  
સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર.



सत्यमेव जयते

REGISTERED No. G/GNR/2

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLVIII] THURSDAY, MARCH 8, 2007/PHALGUNA 17, 1928

[No. 10

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A

Orders and Notifications (Other than those published in Part IV-B)  
Under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

શિક્ષણ વિભાગ

જાહેરનામું

સચિવાલય, ગાંધીનગર, ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૦૬.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૭.

ક્રમાંક : કેએસએચ/૧૯/કેએચપીએસ/૧૦૨૦૦૨/૮૮/ચ:-મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો, ૧૯૪૮ વધુ સુધારતા નિયમોનો અમુક મુસદ્દો, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૭ (સન ૧૯૪૭ના મુંબઈના ૬૧મા)ની કલમ ૬૩ની પેટા-કલમ (૩)થી ઠરાવ્યા પ્રમાણે, તારીખ: ૨૭મી એપ્રિલ, ૨૦૦૬ના શિક્ષણ વિભાગના સરકારી જાહેરનામા ક્રમાંક: કેએસએચ/૧૦/કેએચપીએસએચ/૧૦૨૦૦૨/૮૮/ચ હેઠળ, તારીખ: ૧૧મી મે, ૨૦૦૬ના ગુજરાત સરકારી રાજપત્ર, ભાગ-૧-એ, સેન્ટ્રલ સેક્શનના પાના ૮થી ૯ ઉપર પ્રસિધ્ધ કર્યો હતો અને તેનાથી અસર થવાનો સંભવ હોય તે તમામ વ્યક્તિઓ પાસેથી સદરહું જાહેરનામાની રાજપત્રમાં પ્રસિધ્ધિની તારીખથી ત્રીસ દિવસની અંદર વાંધા અથવા સૂચનો મંગાવવામાં આવ્યા હતાં;

અને સદરહું જાહેરનામાના મુસદ્દાના સંબંધમાં, સરકારને કોઈ વાંધા અથવા સૂચનો મળેલ નથી;

તેથી, હવે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૭ (સન ૧૯૪૭ના મુંબઈના ૬૧મા)ની કલમ ૬૩ની પેટા-કલમ (૧)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો, ૧૯૪૮ વધુ સુધારવા નીચેના નિયમો કરે છે:-

૧. આ નિયમો મુંબઈ પ્રાથમિક શિક્ષણ (ગુજરાત દ્વિતીય સુધારા) નિયમો, ૨૦૦૬ કહેવાશે.

૨. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો, ૧૯૪૮માં, નિયમ ૧૦૬(ક)માં, પેટા-નિયમ(૪)માં, ખંડ (૫)ને બદલે, નીચેનો મજકૂર મૂકવો :-

“(૫) સહાયક અનુદાન મેળવતી માન્ય ખાનગી પ્રાથમિક શાળાની શિક્ષણ ફીના દર, અધ્યાપકીય સ્ટાફના પગારધોરણ અને ભથ્થાં, સરકાર, વખતોવખત, મંજૂર કરે તેવા રહેશે.”.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

પોપટસિંહ વાઘેલા,  
સરકારના ઉપસચિવ.



REGISTERED No. G/GNR/2

सत्यमेव जयते

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLVIII]

THURSDAY, MARCH 29, 2007/CAITRA 8, 1929

[No. 13

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A

### CENTRAL SECTION

Orders and Notifications (Other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર

તા. ૧-૨-૨૦૦૭ થી તા. ૨૮-૨-૨૦૦૭ દરમિયાન પ્રસિધ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી

અનુક્રમ નંબર	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિધ્ધિની તારીખ	વિભાગનું નામ
ભાગ-૧-અ				
૧	૬	કેવી-૫૭ ઓફ ૨૦૦૭-એમઆઈએસસી-૮૦૨૦૦૬-૩૧૬૦-પી	૧-૨-૦૭	શ.વિ. અને શ.ગૃહ.નિ. વિભાગ
૨	૭	કેવી-૫૮ ઓફ ૨૦૦૭-એમઆઈએસસી-૮૦૨૦૦૬-૩૧૬૦-પી	૧-૨-૦૭	શ.વિ. અને શ.ગૃહ.નિ. વિભાગ
૩	૮	કેવી-૫૯ ઓફ ૨૦૦૭-એમઆઈએસસી-૮૦૨૦૦૬-૩૧૬૦-પી	૧-૨-૦૭	શ.વિ. અને શ.ગૃહ.નિ. વિભાગ
૪	૯	કેવી-૬૦ ઓફ ૨૦૦૭-એમઆઈએસસી-૮૦૨૦૦૬-૩૧૬૦-પી	૧-૨-૦૭	શ.વિ. અને શ.ગૃહ.નિ. વિભાગ
૫	૧૦	કેવી-૧ ઓફ ૨૦૦૭-એમઆઈએસસી-૧૦૨૦૦૬-૪૦૩-બી	૧૩-૨-૦૭	પં. ગ્રા.ગૃ.નિ. વિભાગ
૬	૧૧	કેપી-૨ ૨૦૦૭-પસમ-૧૦૨૦૦૬-૨૦૮૭-પાર્ટફાઈલ-૬ તા. ૧૩-૨-૦૭	૨૧-૨-૦૭	પં. ગ્રા.ગૃ.નિ. વિભાગ
૭	૧૨	કેપી-૩ ઓફ ૨૦૦૭-જીએનપી-૨૦૦૦-૩૮૪-બી	૨૨-૨-૦૭	પં. ગ્રા.ગૃ.નિ. વિભાગ

જે. એ. શાહ,  
શ્રેયાન વ્યવસ્થાપક,  
સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર.

I-A- 5

5

સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર.



सत्यमेव जयते

REGISTERED No. G/GNR/2

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLVIII]

THURSDAY, APRIL 26, 2007/VAISAKHA 6, 1929

[No. 17

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A

### CENTRAL SECTION

Orders and Notifications (Other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

શ્રેયાન વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર

તા. ૧-૩-૨૦૦૭ થી તા. ૩૧-૩-૨૦૦૭ દરમિયાન પ્રસિધ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી

અનુક્રમ નંબર	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિધ્ધિની તારીખ	વિભાગનું નામ
૧	૨	૩	૪	૫
ભાગ-૧-અ				
૧.	૧૩	કેપી-૪-૨૦૦૬- પીઆરએમ-૧૦૮૪-૪	૧-૩-૦૭	પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિ.
૨.	૧૪	કેવી-૮૭ થી ૧૧૫-૨૦૦૭-એનપીએમ- ૧૩૨૦૦૫-૭૪૨૮(૪૭) થી (૭૫)-આર	૫-૩-૦૭	શ.વિ.અને શ.ગૃહ નિ. વિભાગ
૩.	૧૫	કેપી-૬-ELC-૧૦૨૦૦૭-૫૭૨-જી	૬-૩-૦૭	પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિ.
૪.	૧૬	કેવી-૧૧૮થી-૨૦૦૭-એનપીએમ- ૧૩૨૦૦૭-૧૧૫૦-આર	૧૮-૩-૦૭	શ.વિ.અને શ.ગૃહ નિ. વિભાગ

જે. એ. શાહ,  
શ્રેયાન વ્યવસ્થાપક,  
સરકારી મધ્યસ્થ મુદ્રણાલય,  
ગાંધીનગર.

I-A-6

6

સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર.



©



सत्यमेव जयते

REGISTERED No. G/GNR/2

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLVIII]

THURSDAY, MAY 31, 2007/JYAISTHA 10, 1929

[No. 22

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A CENTRAL SECTION

Orders and Notifications (Other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal,  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

શ્રેયાન વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર

તા. ૧-૪-૨૦૦૭ થી ૩૦-૪-૨૦૦૭ દરમિયાન પ્રસિધ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી

અનુક્રમ નંબર	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિધ્ધિની તારીખ	વિભાગનું નામ
૧	૨	૩	૪	૫
		ભાગ - ૧ અ		
૧	૧૭	કેપી-૬-૨૦૦૭-ઈએલસી-૧૦૯૭-૮૦૮-ભાગ-૧ ગ	૨-૪-૨૦૦૭	પં. અને ગ્રામ ગૃહ નિ. વિભાગ
૨	૧૮	કેપી-૧૨૯-૨૦૦૭-એનપીએમ-૧૩૨૦૦૭-૧૮૪૩-આર	૪-૪-૨૦૦૭	શ.વિ. અને શ.ગૃ.નિ. વિભાગ
૩	૧૯	કેપી-૭-૨૦૦૭-એલએફએસ-૨૦૦૪-૧૩૪૪-જે	૨૫-૪-૨૦૦૭	પં. અને ગ્રામ ગૃહ નિ. વિભાગ

જે. એ. શાહ,

શ્રેયાન વ્યવસ્થાપક,  
સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર.

I-A-7

7

સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર.





सत्यमेव जयते

REGISTERED No. G/GNR/2

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLVIII]

THURSDAY, JUNE 28, 2007/ASADHA 7, 1929

[No. 26

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A

### CENTRAL SECTION

Orders and Notifications (Other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર

તા. ૧-૫-૨૦૦૭ થી તા. ૩૧-૫-૨૦૦૭ દરમિયાન પ્રસિધ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી

અનુક્રમ નંબર	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિધ્ધિની તારીખ	વિભાગનું નામ
ભાગ-૧-અ				
૧	૨૦	કેપીવી-૧-એસપીએન-પી-૪	૧૬-૫-૦૭	વિકાસ કમિશ્નરશ્રી, ગુ.રા., ગાંધીનગર.
૨	૨૧	કેવી-૧૭૧-૨૦૦૭- એનપીએમ-૧૩૨૦૦૫-૭૪૨૯- આર	૨૮-૫-૦૭	શ.વિ. વિભાગ
૩	૨૨	કેપીવી-૨-એસપીએન-પી-૪	૨૮-૫-૦૭	વિકાસ કમિશ્નરશ્રી, ગુ.રા., ગાંધીનગર.

જે. એ. શાહ,  
શ્રેયાન વ્યવસ્થાપક,  
સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર.



# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLVIII]

THURSDAY, JULY 26, 2007/SRAVANA 4, 1929

[No. 30

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A CENTRAL SECTION

Orders and Notifications (other than those published in Part IV-B) under the Gujarat Local Boards, Village Panchayats, Municipal Boroughs, District Municipal, Primary Education and Local Fund Audit Acts.

### વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર

તા. ૧-૬-૨૦૦૭ થી તા. ૩૦-૬-૨૦૦૭ દરમિયાન પ્રસિધ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી

અનુક્રમ નંબર	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ ભાગ--૧ અ	પ્રસિધ્ધિની તારીખ	વિભાગનું નામ
૧	૨	૩	૪	૫
૧	૨૩	કેપી-૬-૨૦૦૭ જીએનપી-૨૦૦૦-૩૯૪-બ	૧/૬/૦૭	પંચાયત અને ગ્રામ ગૃ.નિ. વિભાગ
૨	૨૪	કેવી-૧૭૩-૨૦૦૭-એનપીએમ-૧૩૨૦૦૭-૧૬૭૦-આર	૨/૬/૦૭	શહેરી વિભાગ
૩	૨૫	કેપી-૮-૨૦૦૭-ઈએલસી-૧૦૮૭-૮૦૮ ભાગ-I જી.	૪/૬/૦૭	પંચાયત અને ગ્રામ ગૃ.નિ. વિભાગ
૪	૨૬	કપવ-૩-૫૬૫-પં-૪.	૬/૬/૦૭	વિ. કમિ. ગુ.રા. ગાંધીનગર.
૫	૨૭	કપવ-૪-૫૬૫-પં-૪.	૧૧/૬/૦૭	વિ. કમિ. ગુ.રા. ગાંધીનગર.
૬	૨૮	કપવ-૫-૫૬૫-પં-૪.	૧૩/૬/૦૭	વિ. કમિ. ગુ.રા. ગાંધીનગર.
૭	૨૯	કેપી-૧૨-૨૦૦૭-પીઆરઆર-૧૧૮૪-૫૧૦ ૯(૫૮) ડી	૧૪/૬/૦૭	પંચાયત અને ગ્રામ ગૃ.નિ. વિભાગ
૮	૩૦	કપવ-૬-૫૬૫-પં-૪.	૨૦/૬/૦૭	વિ. કમિ. ગુ.રા. ગાંધીનગર.
૯	૩૧	કેવી-૧૭૬-૨૦૦૭- એએમએન-૨૦૨૦૦-૭૧૨૨-ડી	૨૨/૬/૦૭	શહેરી વિકાસ વિભાગ
૧૦	૩૨	કેવી-૧૭૭-૨૦૦૭-એએમએન-૮૦૮૫-૨૪૫૦-પી	૨૨/૬/૦૭	શહેરી વિકાસ વિભાગ
૧૧	૩૩	કેવી-૧૮૩-૨૦૦૭-એનપીએમ-૧૩૨૦૦૫-૭૪૨૯-આર	૨૨/૬/૦૭	શહેરી વિકાસ વિભાગ
૧૨	૩૪	કશ-૩૭-નજીમ-૨૩૦૬-૯૭૧-ચ	૨૭/૬/૦૭	શિક્ષણ વિકાસ વિભાગ
૧૩	૩૫	કેવી-૧૮૩-૨૦૦૭-એનપીએમ-૧૩૨૦૦૭-૩૬૦૬-આર	૨૮/૬/૦૭	શ. વિકાસ અને શ.ગૃ.નિ. વિભાગ

જે. એ. શાહ

ગ્રેયાન વ્યવસ્થાપકશ્રી,  
સ.મ. મુદ્રણાલય, ગાંધીનગર.

©



सत्यमेव जयते

REGISTERED No. G/GNR/2

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLVIII]

THURSDAY, AUGUST 30, 2007/BHADRA 8, 1929

[ No. 35

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A

### CENTRAL SECTION

Order and Notification (Other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર

તા. ૧-૭-૨૦૦૭ થી તા. ૩૧-૭-૨૦૦૭ દરમિયાન પ્રસિધ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી

અનુક્રમ નંબર	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિધ્ધિની તારીખ	વિભાગનું નામ
૧	૨	૩	૪	૫
ભાગ-૧-અ				
૧	૩૬	કપવ-૭-એસપીએન-પં.૪	૩-૭	વિકાસ કમિશનરશ્રી, ગુ.રા., ગાંધીનગર
૨	૩૭	કપવ-૮-૯-એસપીએન-પં.૪	૩-૭	વિકાસ કમિશનરશ્રી, ગુ.રા., ગાંધીનગર
૩	૩૮	કશ-૩૮, ૩૯, ૪૦-૪૧-નશમ-૨૧૦૬-૩૩૭-ચ	૬-૭	શિક્ષણ વિભાગ
૪	૩૯	કેપી-૧૪-૨૦૦૭-એલએફએસ-૨૦૦૪-૧૨૦૮-જ	૧૨-૭	પં. અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગ
૫	૪૦	કેપી-૧૫-૨૦૦૭-ઈએલસી-૧૦૨૦૦૭-૫૭૨-ગ	૧૨-૭	પં. અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગ
૬	૪૧	કેવી-૨૦૪-૨૦૦૭-એનપીએલ-૪૫૦૬-મ-૧૯૦-મ	૧૩-૭	શ.વિ. અને શ.ગૃહ નિ. વિ.
૭	૪૨	કશ-૪૨-નશમ-૨૧૦૭-૭૧૬-ચ	૨૦-૭	શિક્ષણ વિભાગ
૮	૪૩	કશ-૪૩-નશમ-૨૩૦૬-૮૧૯-ચ, તા. ૨૫-૭	૨૭-૭	શિક્ષણ વિભાગ

જે. એ. શાહ,

શ્રેયાન વ્યવસ્થાપકશ્રી,

સ.મ. મુદ્રણાલય, ગાંધીનગર.



सत्यमेव जयते

REGISTERED No. G/GNR/2

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLVIII] THURSDAY, SEPTEMBER 6, 2007 /BHADRA 15, 1929 [No. 36]

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A

### CENTRAL SECTION

Order and Notification (Other than those published in Part IV-B)  
Under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

### PANCHAYATS, RURAL HOUSING AND RURAL DEVELOPMENT DEPARTMENT

#### Notification

Sachivalaya, Gandhinagar 3<sup>rd</sup> September, 2007.

GUJARAT PANCHAYATS ACT, 1993.

No.KP/19 OF 2007/VBN/2006/2555//CH:-In exercise of the powers conferred by Section 7 of the Gujarat Panchayats Act, 1993 (Guj. 18 of 1993), and after consultation with the concerned village Panchayat, the Taluka Panchayat, Bhuj and the District Panchayat, Kutch, the Government of Gujarat hereby:-

- (1) excludes the local areas shown in column 5 from the local areas of existing village shown in column 3 of the schedule, and after exclusion of the said local areas;
- (2) specifies the new villages named in column 6, comprising of the local area shown in column 7 of the said Schedule.

### SCHEDULE

Sr. No.	Name of Taluka	Name of existing village.	Local area covered in existing village.	Local area excluded from existing village	Name of the new villages formed after division.	Area covered in new villages.
1	2	3	4	5	6	7
1.	Bhuj	Mota-Dinara Goup Gram Panchayat	1. Mota Dinara 2. Motabandha 3. Dhandhi 4. Lakhavandh 5. Talvandh 6. Kansvandh  7. Nana Dinara 8. Alaiya Vandh 9. Fazalvandh 10. Harunvandh 11. Mauvarvandh	1. Nana Dinara 2. Alaiya Vandh 3. Fazalvandh 4. Harunvandh 5. Mauvarvandh	1. Mota-Dinara Group Gram Panchayat	1. 1. Mota Dinara Petapara 2. Motabandha Petapara 3. Dhandhi Petapara 4. Lakhavandh Petapara 5. Talvandh Petapara 6. Kansvandh Petapara .....



Sr. No.	Name of Taluka	Name of existing village.	Local area covered in existing village.	Local area excluded from existing village	Name of the new villages formed after division.	Area covered in new villages.
1	2	3	4	5	6	7
					2. Nana Dinara Group Panchayat	2. 1. Nana Dinara (Revenue Village) 2. Alaiya Vandh Petapara 3. Fazalvandh Petapara 4. Harunvandh Petapara 5. Mauvarvandh Petapara

By order and in the name of the Governor of Gujarat,

**K. S. PATEL,**

Deputy Secretary to Government.



सत्यमेव जयते

REGISTERED No. G/GNR/2

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLVIII] THURSDAY, SEPTEMBER 20, 2007 /BHADRA 29, 1929 [No. 38

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A

### CENTRAL SECTION

Order and Notification (Other than those published in Part IV-B)  
Under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

### PANCHAYATS, RURAL HOUSING AND RURAL DEVELOPMENT DEPARTMENT

#### Notification

Sachivalaya, Gandhinagar 11<sup>th</sup> September, 2007.

### GUJARAT PANCHAYATS ACT, 1993.

No.KP/22 OF 2007/VBN/2002/669/CH:-In exercise of the powers conferred by Section 7 of the Gujarat Panchayats Act, 1993 (Guj. 18 of 1993), and after consultation with the concerned village Panchayat, the Taluka Prantij Panchayat, and the Sabarkantha District Panchayat, the Government of Gujarat hereby:-

- (1) excludes the local areas shown in column 5 from the local areas of existing village shown in column 3 of the schedule, and after exclusion of the said local areas;
- (2) specifies the new villages named in column 6, comprising of the local area shown in column 7 of the said Schedule.

### SCHEDULE

Sr. No.	Name of Taluka	Name of existing village.	Local area covered in existing village.	Local area excluded from existing village	Name of the new villages formed after division.	Area covered in new villages.
1	2	3	4	5	6	7
1.	Prantij	Amodra Gram Panchayat	1. Amodra Revenue Village 2. Rampura (Petapara)	Rampura	1. Amodra 2. Rampura	1. Amodra Revenue Village 2. Rampura (Petapara)

**GUJARAT PANCHAYATS ACT, 1993.**

**No.KP/23 OF 2007/VBN/102007/812/CH:-**In exercise of the powers conferred by Section 7 of the Gujarat Panchayats Act, 1993 (Guj. 18 of 1993), and after consultation with the concerned village Panchayat, the Taluka Modasa Panchayat, and the Sabarkantha District Panchayat, the Government of Gujarat hereby:-

- (1) excludes the local areas shown in column 5 from the local areas of existing village shown in column 3 of the schedule, and after exclusion of the said local areas;
- (2) specifies the new villages named in column 6, comprising of the local area shown in column 7 of the said Schedule.

**SCHEDULE**

Sr. No.	Name of Taluka	Name of existing village.	Local area covered in existing village.	Local area excluded from existing village	Name of the new villages formed after division.	Area covered in new villages.
1	2	3	4	5	6	7
1.	Modasa	Varathu Group Gram Panchayat (Revenue Village)	1. Varathu (Revenue Village) 2. Surpur (Revenue Village) 3. Maradiya Petapara	1. Surpur	1. Varathu (Revenue Village) 2.(1) Surpur (Revenue Village)  (2) Maradiya (Petapara)	1. Varathu (Revenue Village) (1) Surpur Gram Panchayat (Revenue Village) 2 Rampura (Petapara)

**GUJARAT PANCHAYATS ACT, 1993.**

**No.KP/24 OF 2007/VBN/2006/4830/CH:-**In exercise of the powers conferred by Section 7 of the Gujarat Panchayats Act, 1993 (Guj. 18 of 1993), and after consultation with the concerned village Panchayat, the Taluka Panchayat, Idar and the District Panchayat, Sabarkantha the Government of Gujarat hereby :-

- (1) excludes the local areas shown in column 5 from the local areas of existing village shown in column 3 of the schedule, and after exclusion of the said local areas;
- (2) specifies the new villages named in column 6, comprising of the local area shown in column 7 of the said Schedule.

**SCHEDULE**

Sr. No.	Name of Taluka	Name of existing village.	Local area covered in existing village.	Local area excluded from existing village	Name of the new villages formed after division.	Area covered in new villages.
1	2	3	4	5	6	7
1.	Idar	Kukadiya Group Gram Panchayat	1. Kukadiya (Revenue Village) 2. Vansdol (Revenue Village)	1. Vansdol (Revenue Village)	1. Kukadiya Gram Panchayat 2. Vansdol Gram Panchayat	1. Kukadiya Revenue Village 2 Vansdol Revenue Village

**GUJARAT PANCHAYATS ACT, 1993.**

**No.KP/25 OF 2007/VBN/2006/5077/CH:-**In exercise of the powers conferred by Section 7 of the Gujarat Panchayats Act, 1993 (Guj. 18 of 1993), and after consultation with the concerned village Panchayat, the Taluka Panchayat, Wav and the District Panchayat, Banaskantha the Government of Gujarat hereby :-

- (1) excludes the local areas shown in column 5 from the local areas of existing village shown in column 3 of the schedule, and after exclusion of the said local areas;
- (2) specifies the new villages named in column 6, comprising of the local area shown in column 7 of the said Schedule.

**SCHEDULE**

Sr. No.	Name of Taluka	Name of existing village.	Local area covered in existing village.	Local area excluded from existing village	Name of the new villages formed after division.	Area covered in new villages.
1	2	3	4	5	6	7
1.	Wav	Panesada Group Gram Panchayat	1. Panesda (Revenue Village) 2. Akoli (Revenue Village) 3. Tobha (Revenue Village) 4. Arjanpura (Revenue Village) 5. Tejpura 1-2 (Revenue Village)	1. Arjanpura (Revenue Village) 2. Tejpura 1-2 (Revenue Village)	1. Panesada Group Gram Panchayat     2. Arjanpura Group Gram Panchayat	1. Panesda (Revenue Village) 2. Akoli (Revenue Village) 3. Tobha (Revenue Village)   1. Arjanpura (Revenue Village) 2. Tejpura 1-2 (Revenue Village)

By order and in the name of the Governor of Gujarat,

**K. S. PATEL,**

Deputy Secretary to Government.

18/9/07



©



सत्यमेव जयते

REGISTERED NO. G/GNR/2

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLVIII] THURSDAY, SEPTEMBER 27, 2007/ ASVINA 5, 1929 [NO. 39

Separate paging is given to this part in order that it may be filed as a Separate Compilation.

PART I-A

CENTRAL SECTION

Orders and Notifications (Other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

PANCHAYATS, RURAL HOUSING AND RURAL DEVELOPMENT DEPARTMENT

Notification

Sachivalaya, Gandhinagar, 3rd September, 2007.

## GUJARAT PANCHAYATS ACT, 1993

No.KP/20 of 2007/VBN/102007/2011/CH.- In exercise of the powers conferred by section 7 of the Gujarat Panchayats act, 1993 (Guj. 18 of 1993) and after consultation with the concerned village panchayat, the Taluka Panchayat, Ahmedabad and the District Panchayat Dhandhuka the Government of Gujarat hereby :

- (1) excludes the local areas shown in column 5 from the local areas of existing village shown in column 3 of the schedule, and after exclusion of the said local areas ;
- (2) specifies the new villages named in column 6, comprising of the local area shown in column 7 of the said Schedule.

### SCHEDULE

Sr. No.	Name of Taluka	Name of Existing Village	Local area Covered in existing village	Local area excluded from existing village	Name of the new Village formed After division	Area covered in new village
1	Dhandhuka	Ambali Gram Panchayat	1) Ambali (R.V.) 2) Sarasala Para (Peta Para) 3) Dodhiapara (Petapara)	1) Sarasala Para (Peta Para) 2) Dodhiapara (Petapara)	1) Ambali Gram Panchayat 2) Sarasala Para Gram Panchayat	1) Ambali Gram Panchayat 2) (1) Sarasala Para Gram Panchayat (2) Dodhiapara (Petapara)

By order and in the name of the Governor of Gujarat,

K. S. PATEL,  
Deputy Secretary to Government.

વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર

તા. ૧-૮-૨૦૦૭ થી ૩૧-૮-૨૦૦૭ દરમિયાન પ્રસિદ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી

અનુક્રમ નંબર	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિદ્ધિની તારીખ	વિભાગનું નામ
૧	૨	૩	૪	૫
ભાગ - ૧-અ				
૧	૪૪	કેવી-૨૨૮ ઓફ ૨૦૦૭-એનપીએલ-૪૫૦૬-એમ-૧૯૦-એમ.	૯-૮-૦૭	શ.વિ. અને શ.ગૃહ નિર્માણ વિભાગ
૨	૪૫	કેવી-૨૩૧ ઓફ ૨૦૦૭-એનપીએલ-૪૫૦૫-૨૦૮૭-એમ.	૧૪-૮-૦૭	શ.વિ. અને શ.ગૃહ નિર્માણ વિભાગ
૩	૪૬	કેપી-૧૮ ઓફ ૨૦૦૭-ઈએલસી-૧૦૨૦૦૭-૩૮૧૭-જી	૨૪-૮-૦૭	પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ

જે. એ. શાહ,  
શ્રેયાન્ત વ્યવસ્થાપક,  
સરકારી મધ્યસ્થ મુદ્રણાલય,  
ગાંધીનગર.

©



REGISTERED NO. G/GNR/2

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLVIII]

THURSDAY, OCTOBER 25, 2007/KARTIKA 3, 1929

[NO. 43]

Separate paging is given to this part in order that it may be filed as a Separate Compilation.

PART I-A

CENTRAL SECTION

Orders and Notifications (Other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર

તા. ૧-૯-૨૦૦૭ થી ૩૦-૯-૨૦૦૭ દરમિયાન પ્રસિદ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી

અનુક્રમ નંબર	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિદ્ધિની તારીખ	વિભાગનું નામ
૧	૨	૩	૪	૫
ભાગ - ૧-અ				
૧	૪૭	કેવી-૨૩૮ ઓફ ૨૦૦૭-એનપીએલ-૪૫૦૫-૨૦૮૭(૩)-એમ.	૩-૯-૦૭	શ.વિ. અને શ.ગૃ.નિ.વિ.
૨	૪૮	કેપી-૨૧-ઈએલસી-૧૦૨૦૦૭-૫૭૨-જી.	૭-૯-૦૭	પં.ગ્રા.ગૃહ નિ. અને ગ્રા. વિ. વિભાગ
૩	૪૯	કેવી-૨૪૫-૨૦૦૭-જેકેટી-૮૦-૨૦૦૭-૧૯૬૩-પી.	૧૨-૯-૦૭	શહેરી વિ. અને શહેરી ગૃહ નિ. વિભાગ
૪	૫૦	કેવી-૨૫૦ થી ૨૫૭ ઓફ-૨૦૦૭-એન.પી.એલ.-૪૫૦૫- ૨૦૮૭-(૨૦) એમ.	૧૭-૯-૦૭	"
૫	૫૧	કેપી-૨૬-ઈએલસી-૧૦૨૦૦૭-૫૬૨-જી.	૨૧-૯-૦૭	પં.ગ્રા.ગૃહ નિ. અને ગ્રા. વિ. વિભાગ
૬	૫૨	કેવી-૨૬૧ ઓફ ૨૦૦૭-એનપીએલ-૪૫૦૫-૨૦૮૭(૭)-એમ ૨૧-૯-૦૭	૨૧-૯-૦૭	શહેરી વિ. અને શહેરી ગૃહ નિ. વિભાગ
૭	૫૩	કેવી-૨૬૯ ઓફ ૨૦૦૭-એનપીએમ-૧૦૨૦૦૫-૨૦૫૪-આર.	૨૮-૯-૦૭	"

જે. એ. શાહ,  
શ્રેયાન વ્યવસ્થાપક,  
સરકારી મધ્યસ્થ મુદ્રણાલય,  
ગાંધીનગર.

I-A-14

18.

સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર.



REGISTERED No. G/GNR/2

सत्यमेव जयते

# The Gujarat Government Gazette

PUBLISHED BY AUTHORITY

Vol. XLVIII]

THURSDAY, NOVEMBER 29, 2007/AGRAHAYANA 8, 1929

[No. 48]

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

## PART I-A

### CENTRAL SECTION

Orders and Notifications (Other than those published in Part IV-B)  
under the Gujarat Local Boards, Village Panchayats, Municipal  
Boroughs, District Municipal, Primary Education and Local  
Fund Audit Acts.

વ્યવસ્થાપક, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર

તા. ૧-૧૦-૨૦૦૭ થી તા. ૩૧-૧૦-૨૦૦૭ દરમિયાન પ્રસિધ્ધ થયેલ અસાધારણ રાજપત્રની યાદી

અનુ ક્રમ નંબર	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિધ્ધિની તારીખ	વિભાગનું નામ
ભાગ-૧-અ				
૧	૫૪	કેવી-૨૭૦ નો ૨૦૦૭/એનપીએન-૪૫૦૫-૨૦૮૭(૩)એમ.	૧-૧૦-૦૭	શ.વિ. અને શ.ગૃહ.નિ. વિ.
૨	૫૫	કેપી-૨૮ નો ૨૦૦૭/વીવીએન-૨૦૦૧-૨૫૧૦-ચ.	૧-૧૦-૦૭	પં.ગ્રામ ગૃહ અને ગૃ.નિ.વિ.
૩	૫૬	કેપી-૨૮ નો ૨૦૦૭/વીવીએન-૨૦૦૧-૨૮૦૩-ચ.	૧-૧૦-૦૭	"
૪	૫૭	કેપી-૩૧ નો ૨૦૦૭/વીવીએન-૨૦૦૭-૮૧૫-ચ.	૧-૧૦-૦૭	"
૫	૫૮	કેપી-૩૨ નો ૨૦૦૭/વીવીએન-૪૬૪૮-ચ.	૧-૧૦-૦૭	"
૬	૫૯	કેપી-૩૩ નો ૨૦૦૭/વીવીએન-૨૦૦૦-૭૫-ચ.	૧-૧૦-૦૭	"
૭	૬૦	કેપી-૩૫ નો ૨૦૦૭/વીવીએન-૨૦૦૬-૪૭૪૮-ચ.	૧-૧૦-૦૭	"
૮	૬૧	કેપી-૩૭ નો ૨૦૦૭/વીવીએન-૨૦૦૨-૨૩૮૦-ચ.	૧-૧૦-૦૭	"
૯	૬૨	કેપી-૩૮ નો ૨૦૦૭/વીવીએન-૨૦૦૬-૧૮૫૧-ચ.	૧-૧૦-૦૭	"
૧૦	૬૩	કેપી-૩૯ નો ૨૦૦૭/વીવીએન-૨૦૦૬-૪૪૬૪-ચ.	૧-૧૦-૦૭	"
૧૧	૬૪	કેપી-૪૧ નો ૨૦૦૭/વીવીએન-૧૦૨૦૦૬-૫૦૭૮-ચ.	૧-૧૦-૦૭	"
૧૨	૬૫	કેપી-૪૨ નો ૨૦૦૭/વીવીએન-૧૦૨૦૦૭-૮૧૩-ચ.	૧-૧૦-૦૭	"
૧૩	૬૬	કેપી-૪૩ નો ૨૦૦૭/વીવીએન-૧૦૨૦૦૭-૨૦૦૫-ચ.	૧-૧૦-૦૭	"
૧૪	૬૭	કેપી-૪૪ નો ૨૦૦૭/વીવીએન-૨૦૦૭-૨૪૦૫-ચ.	૧-૧૦-૦૭	"
૧૫	૬૮	કેપી-૪૬૦ નો ૨૦૦૭/વીવીએન-૨૦૦૬-૧૮૫૩-ચ.	૧-૧૦-૦૭	"
૧૬	૬૯	કેપી-૪૭ નો ૨૦૦૭/વીવીએન-૨૦૦૬-૨૫૬૫-ચ.	૧-૧૦-૦૭	"
૧૭	૭૦	કેપી-૪૮ નો ૨૦૦૬/વીવીએન-૨૦૦૬-૪૪૬૬-ચ.	૧-૧૦-૦૭	"
૧૮	૭૧	કેપી-૪૯ નો ૨૦૦૭/વીવીએન-૨૦૦૬-૪૭૪૮-ચ.	૧-૧૦-૦૭	"
૧૯	૭૨	કેપી-૫૦ નો ૨૦૦૭/વીવીએન-૨૦૦૬-૨૩૪૪-ચ.	૧-૧૦-૦૭	"
૨૦	૭૩	કેપી-૫૧ નો ૨૦૦૭/વીવીએન-૨૦૦૧-૨૩૬૯-ચ.	૧-૧૦-૦૭	"



અનુ ક્રમ નંબર	અસાધારણ રાજપત્રનો નંબર	જાહેરનામાનો નંબર અને તારીખ	પ્રસિધ્ધિની તારીખ	વિભાગનું નામ
૨૧	૭૪	કેપી-૫૨ નો ૨૦૦૭/વીબીએન-૨૦૦૬-૪૫૬૫-ચ	૪-૧૦-૦૭	પં.ગ્રામ ગૃહ અને ગૃ.નિ.વિ.
૨૨	૭૫	કેપી-૫૩ નો ૨૦૦૭/વીબીએન-૨૦૦૬-૪૭૪૬-ચ.	૪-૧૦-૦૭	"
૨૩	૭૬	કેપી-૫૪ નો ૨૦૦૭/વીબીએન-૨૦૦૬-૫૦૨૭-ચ.	૪-૧૦-૦૭	"
૨૪	૭૭	કેવી-૨૦૦૭ નો ૨૭૮/જનમ-૮૦૨૦૦૬-૫૪૨૮-પી.	૬-૧૦-૦૭	શ.વિ. અને શ.ગૃહ.નિ. વિ.
૨૫	૭૮	કેપી-૫૫ નો ૨૦૦૭/વીબીએન-૨૦૦૨/એમ.૧૦૪-ચ.	૮-૧૦-૦૭	પં.ગ્રામ ગૃહ અને ગૃ.નિ.વિ.
૨૬	૭૯	કેપી-૫૬ નો ૨૦૦૭/વીબીએન-૨૦૦૨-૧૭૧૯-ચ.	૮-૧૦-૦૭	"
૨૭	૮૦	કેવી-૨૭૯ નો ૨૦૦૭/એનપીએલ-૪૫૦૫-૨૦૮૩(૩)એમ.	૮-૧૦-૦૭	શ.વિ. અને શ.ગૃહ.નિ. વિ.
૨૮	૮૧	કેવી-૨૮૭ નો ૨૦૦૭/એનપીએમ-૧૩૨૦૦૭- ૫૯૩૭/આર.	૨૯-૧૦-૦૭	"

જે. એ. શાહ,  
શ્રેયાનં વ્યવસ્થાપક,  
સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર.